

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન જુલાઈ 31 નાં રોજ રિઓપનીંગ સ્ટેજ (તબક્કો) 3 માં પ્રવેશે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 30, 2020) – પીલ રીજીયનને તબક્કો 3 માં આગળ વધવાની પરવાનગી આપતી ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની ગઈકાલની ઘોષણા પછી, સીટી આ શુક્રવારે, જુલાઈ 31 નાં રોજ બ્રેમ્પટનમાં વધારે ધંધાઓ અને સેવાઓના સુરક્ષિત રિઓપનીંગ માટે તૈયારી કરી રહ્યું છે.

તબક્કો 3 માં શહેરની સગવડો, સેવાઓ અને કાર્યક્રમો

પાર્ક્સ, પ્લેગ્રાઉન્ડ્સ અને આઉટડોર ફિટનેસ સાધનો

શહેરના બધાં સમતગમતના મેદાનો, સ્પોર્ટ્સ સ્ટ્રક્ચર્સ અને આઉટડોર ફિટનેસ સાધનો શુક્રવાર, જુલાઈ 31 નાં રોજ ફરીથી ખુલશે. રહેવાસીઓને યોગ્ય આરોગ્ય અને સુરક્ષા ઉપાયોનું આચરણ કરવાની સલાહ આપવા પાર્ક્સમાં સાઈન બોર્ડ્સ મૂકવામાં આવશે.

લીગ્સ માટે સમતો સમાડવા આઉટડોર સ્પોર્ટ્સ ફિલ્ડ્સ હવે ખુલ્લી છે, જે પ્રોવિન્સની [રિટર્ન ટુ પ્લે](#) માર્ગરેખાઓને અનુસરે છે.

ઓગસ્ટ 10 થી શરૂ કરીને, પ્રોફેસર્સ લેક પર કનૂ (નાવડી) અને કાયક (એસ્કિમો દ્વારા વપરાતી નાની નાવડી) ભારેથી ઉપલબ્ધ થશે. વિગતો ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ છે, brampton.ca/recreation.

રિક્રિએશન (મનોરંજન) કાર્યક્રમો

ઓગસ્ટ 10 ના અઠવાડિયાથી શરૂ કરીને, સીટી ઓફ બ્રેમ્પટન ઉનાળા માટે લંબાવેલો મનપસંદ મફત આઉટડોર ફિટનેસ કાર્યક્રમ, ફિટનેસ ઈન ધી પાર્ક, ફરીથી શરૂ કરશે. આ આઉટડોર ડ્રોપ-ઇન (ગમે ત્યારે ચાલ્યા આવવાનો) કાર્યક્રમ વિસ્તારવામાં આવી રહ્યો છે જેથી ઉનાળાના હુંફાળા મહિનાઓ દરમિયાન અને મોટા સમૂહોમાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર રાખવું શક્ય હોય તેવા વિસ્તારોમાં રહેવાસીઓને સુરક્ષિત, ખુલ્લી હવામાં ફિટનેસ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય થવા દેવા વધારે વિકલ્પો પૂરા પાડી શકાય. વધારેલી ક્ષમતા માટે દિવસો, સ્થળો, અને ટાર્જમ સ્લોટ્સ વિસ્તારવામાં આવ્યા છે. કાર્યક્રમોમાં બૂટ કેમ્પ, મેડિટેશન (ધ્યાન-ચિંતન), અને Zumba™ (જુમ્બા)નો સમાવેશ થશે. એક સંપૂર્ણ સમયપત્રક વેબસાઈટ પર ઉપલબ્ધ થશે, brampton.ca/recreation.

જાહેર જનતાના ઉપયોગ માટે ઈનડોર પૂલ્સ, ફિટનેસ સગવડો, અને સીમિત ડ્રોપ-ઇન કાર્યક્રમો (માત્ર આરક્ષણથી (રિઝર્વેશનથી) ઉપલબ્ધ) લેબર ડે પછી ફરીથી ખુલશે. પસંદ કરેલા ઈનડોર સ્વીમિંગ પૂલ્સમાં જાહેર સ્વીમ્સ, લેન સ્વીમ્સ, એકવાફિટ, અને એકવા થેરાપી માત્ર આરક્ષણથી ઉપલબ્ધ થશે. ડ્રોપ-ઇન કાર્યક્રમોમાં કળા, સમતો, નૃત્ય (રિસાઈટલ (એક વ્યક્તિ દ્વારા) અને નોન-રિસાઈટલ (સમૂહમાં), STEM (સ્ટેમ - સાયન્સ, ટેકનોલોજી, એન્જનીયરિંગ અને મેથેમેટિક્સ), અને સ્ટેટિંગનો સમાવેશ થશે. ફિટનેસ સગવડો ડ્રોપ-ઇન કાર્ડિયો અને વેઈટ ઝમ વપરાશ માટે ફરીથી ખોલવામાં આવશે. લેબર ડે પછી શરૂ થતા બધાં કાર્યક્રમો અને સેવાઓ અંગેની માહિતી, નોંધણી કેવી રીતે કરવી તે સહિતની માહિતી, આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે brampton.ca/recreation.

બધાં રિક્રિએશન સેન્ટર્સ અત્યારે જાહેર જનતાના વોક-ઇન (ગમે ત્યારે આવીને) વપરાશ માટે બંધ રહે છે. કોઈ પ્રશ્નો માટે, કૃપા કરી 311 નંબર પર કોલ કરશો અથવા અહીં ઈમેઈલ મોકલશો, reconnects@brampton.ca.

તહેવારો અને પ્રસંગો

શહેરમાં બધાં તહેવારો, પ્રાસંગિક આયોજનો, પરફોર્મન્સીસ (પ્રસ્તુતિઓ) અને ધ રોજ સહિતના, સીટી ફેસિલિટીસ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર્સમાં પ્રસંગો માટે સામુદાયિક આયોજનોની પરવાનગીઓ, સપ્ટેમ્બર 7, 2020 નાં રોજ લેબર ડે સુધી, રદ થવાનું ચાલુ રહે છે.

બ્રેમ્પટન લાઈબ્રેરી

પસંદ કરેલી લાઈબ્રેરી શાખાઓમાં કર્બસાઈડ પિકઅપ માટે નવા હોલ્ડ્સ એક માન્ય લાઈબ્રેરી કાર્ડ વડે હવે મૂકવામાં આવે તેવું બની શકે. રહેવાસીઓને વાંચન સાહિત્ય ઓનલાઈન વેબસાઈટ bramptonlibrary.ca પર આરક્ષિત કરવા અને આ સેવા વિતરણમાં સક્રિય પાંચ લાઈબ્રેરી શાખાઓની યાદીમાંથી પસંદગી કરવા આમંત્રિત કરવામાં આવે છે. વિગતો ઓનલાઈન વેબસાઈટ bramptonlibrary.ca પર અને બ્રેમ્પટન લાઈબ્રેરીના Facebook, Twitter, અને Instagram પેજ્સ @bramptonlibrary પર ઉપલબ્ધ છે. અત્યારે, બ્રેમ્પટન લાઈબ્રેરીની બધી શાખાઓ જાહેર જનતા માટે બંધ રહે છે.

તબક્કો 3 સુરક્ષા માર્ગરેખાઓ અને નિયમનો

સીટીની સગવડોમાં આરોગ્ય અને સુરક્ષા ઉપાયો

સમુદાયના આરોગ્ય અને સુરક્ષાને ટોચના સ્થાને રાખીને, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર કડકપણે જાળવવાના ઉપાયો બ્રેમ્પટનના પાર્ક્સ અને ઈનડોર સગવડો ફરીથી ખુલ્લે એટલે તેમાં અમલી બનશે. રહેવાસીઓ પોતાની સાથે ન રહેતી કોઈપણ વ્યક્તિથી ઓછામાં ઓછું 2.0 મીટર (કે છ ફૂટ)નું અંતર બધાં સમયે અચૂક જાળવવું રહ્યું.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા માટે વેબસાઈટ brampton.ca/COVID19 જુઓ, અને કોઈપણ સમયે સીટી ઓફ બ્રેમ્પટન અને રીજીયન ઓફ પીલ સુધી પહોંચવા 311 નંબર પર કૉલ કરો.

સમૂહમાં ભેગા થવું અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું

તબક્કો 3 નાં પ્રોવિન્સિયલ રિઓપનીંગના ભાગરૂપે, ઈનડોરમાં 50 જેટલા લોકોને ભેગા થવાની અને આઉટડોરમાં 100 જેટલા લોકોને ભેગા થવાની પરવાનગી હવે આપવામાં આવી છે. લોકોનું ભેગા થવાનું તમારા ઘર બહારની કોઈપણ વ્યક્તિ અથવા 10-વ્યક્તિઓના સામાજિક વર્તુળથી બે-મીટર શારીરિક અંતર જાળવવાની પ્રોવિન્સની જરૂરિયાતો સાથેના અનુપાલનને અધીન રહે છે.

વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવા અંગે આપણાં શહેરના કટોકટી ઉપાયોના પેટા-કાનૂનો (ઈમરજન્સી મેજર્સ બાય-લોસ) અમલમાં છે, જેમાં લોકોને કોઈ જાહેર મિલકતમાં એકબીજાથી 2.0 મીટરથી ઓછું અંતર રાખવા પર પ્રતિબંધ છે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર નિયમનનું પાલન ન કરતી વ્યક્તિઓને દરેક ગુના માટે લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 સુધીનો દંડ કરી શકાય છે. રહેવાસીઓ બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કૉલ કરી શકે છે.

મેન્ડેટરી (અનિવાર્ય) માર્સ્ક્સ

જુલાઈ 10 થી અમલી, બ્રેમ્પટનમાં બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ માર્સ્ક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવા અનિવાર્ય બન્યા છે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળે. પીલ પબ્લિક હેલ્થની સલાહને અનુસરતા, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બ્રેમ્પટન COVID-19 મેન્ડેટરી ફેસ કવરિંગ્સ બાય-લો પસાર કર્યો, જે ઓક્ટોબર 1, 2020 સુધી અમલમાં રહેશે. વધુ વિગતો માટે વેબસાઈટ જુઓ, brampton.ca/masks.

રિઓપનીંગ અને રિકવરી પરિણામો

પોતાનો રિઓપનીંગ અને રિકવરી પ્લાન જાણાવવામાં મદદ મેળવવા, મે 5 થી જૂન 14, 2020 સુધી, સીટીએ રહેવાસીઓ પર સર્વે કર્યો હતો કે રહેવાસીઓ કેવી રીતે સેવાઓ અને કાર્યક્રમો સુધી પહોંચ મેળવવા ઈચ્છે છે. કુલ 4,500 પ્રતિભાવો મળ્યા હતા. મહત્વની ઝાંખીઓમાં સામેલ છે:

- 87% જેટલા જવાબ આપનારાઓએ જાહેર સુરક્ષાને અગ્રતા આપીને શહેરની સગવડો ફરીથી ખોલવાના અભિગમને પ્રાધાન્ય આપ્યું, પછી ભલે તેમાં વિલંબ થાય.
- 88% જેટલા જવાબ આપનારાઓ સંમત થયા કે સીટીએ શક્ય એટલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા કામ કરવું જોઈએ.
- 82% જેટલા જવાબ આપનારાઓએ શહેરની સેવાઓ સુધી પહોંચ ઓનલાઇન કે ફોનથી મેળવવાને પ્રાધાન્ય આપ્યું.

અવતરણો (ક્વોટ્સ):

“આ ઘોષણા આપણાં સમુદાયે ગયા મહિને કરેલી પ્રગતિનું પરિણામ છે અને એકબીજાને સુરક્ષિત રાખવામાં આપણાં રહેવાસીઓ, ધંધાઓ, ફ્રન્ટલાઇન એમ્પ્લોઈસ (આગવી હરોળના કર્મચારીઓ) અને હેલ્થ કેર પ્રોફેશનલ્સની (આરોગ્ય સંભાળ રાખનાર વ્યવસાયીઓની) ચાલુ રહેલી મહેનતભરી કામગીરી અને સમર્પણ દર્શાવે છે. આપણે આ શુક્રવારે પ્રોવિન્સના રિઓપનીંગના તબક્કા 3 માં પ્રવેશીએ છીએ ત્યારે, હું દરેક વ્યક્તિને યાદ અપાવું છું કે આપણે COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મેળવવા આપણાં પ્રયત્નો અચૂક કરતા રહેવું. આપણે પીલ પબ્લિક હેલ્થની સુરક્ષા માર્ગરેખાઓ અનુસરવા અચૂક કટિબદ્ધ રહેવું જેથી કરીને આપણે રિઓપનીંગ અને રિકવરીમાં સાથે મળીને આગળ વધવાનું ચાલુ રાખી શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણે આપણાં રહેવાસીઓ, ધંધાઓ અને સામુદાયિક સમૂહો પાસેથી સાંભળ્યું છે તેને અનુરૂપ રહીને, સીટી તબક્કો 3 માં સેવાઓનો પુનઃપ્રારંભ કરવામાં અને સગવડોને ફરીથી ખોલવામાં એક સુરક્ષિત અને પરિમિત અભિગમ લેવાનું ચાલુ રાખે છે. આપણે સૌએ આપણાં શહેરની સંપૂર્ણ રિકવરીમાં અને રિઓપનીંગમાં ભૂમિકા ભજવવાની છે અને હું આપણાં રહેવાસીઓને નોન-મેડિકલ માર્ક પહેરીને, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું આચરણ કરીને, પોતાના હાથ અવારનવાર ધોઈને અને જરૂર પડે ત્યારે COVID-19 પરીક્ષણ કરાવીને પોતાનો ભાગ ભજવવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કરું છું.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), મેયરનું રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“COVID-19 સામે આપણી સમગ્ર પ્રતિક્રિયામાં, આ શહેરે રહેવાસીઓ, ધંધાઓ અને સમુદાય માટે સુરક્ષિત અને અનુકૂળ હોય તેવી સેવાઓ અને કાર્યક્રમો આપવાની નવી રીતો રજૂ કરી. આપણે તબક્કો 3 માં પ્રવેશીએ છીએ ત્યારે, પહેલાં કરતા વધારે સારા સુરક્ષા ઉપાયો અમલમાં રહેશે અને આપણે ધંધો સુરક્ષિત રીતે કરવા નવી અને નવીનતમ રીતો શોધતા રહેવાનું ચાલુ રાખીશું જેથી આપણે શહેરના રિઓપનીંગ અને રિકવરીમાં આગળ વધવાનું ચાલુ રાખી રહ્યા હોવાની ખાતરી કરી શકાય.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca